



**RAJ-1601210101041000** Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. IV) (CBCS) Examination**

**March / April – 2019**

**Philosophy**

*(Indian Logic) (Old Course)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) આ પ્રશ્નપત્રમાં પાંચ પ્રશ્નો છે. બધા પ્રશ્નોના ઉત્તર આપો.  
(૨) આંતરિક વિકલ્પને આધારે બધા પ્રશ્નોના ઉત્તરો લખો.  
(૩) જમણી બાજુના અંક ગુણ દર્શાવે છે.

- ૧ ભારતીય તર્કશાસ્ત્રનો જ્ઞાનમીમાંસા સાથેનો સંબંધ સમજાવો. ૧૪  
અથવા  
૧ અનુમાનનું સ્વરૂપ સમજાવો.  
૨ પ્રમાની વ્યાખ્યા અને તેના પ્રકારો સમજાવો. ૧૪  
અથવા  
૨ અનુમાનના ઘટકો જણાવો.  
૩ નવ્ય ન્યાય અનુસાર અનુમાનના પ્રકારો વર્ણવો. ૧૪  
અથવા  
૩ પંચાવયવી અનુમાનનું સ્વરૂપ વિગતે ચર્ચો.  
૪ હેત્વાભાસ એટલે શું ? બાધિત હેત્વાભાસ સમજાવો. ૧૪  
અથવા  
૪ ન્યાય અનુસાર અનુમાનની પ્રક્રિયા.  
૫ ટૂંકમાં જવાબ આપો : (કોઈ પણ બે) ૧૪  
(૧) સદહેતુનાં લક્ષણો વર્ણવો.  
(૨) ભારતીય તર્કશાસ્ત્રની પૃષ્ઠભૂમિ સમજાવો.  
(૩) આશ્રયાસિદ્ધ હેત્વાભાસ  
(૪) સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ.

## ENGLISH VERSION

### Instructions :

- (1) This paper contains five questions. Attempt all of them.
- (2) Give answer of all questions on basis of internal options.
- (3) The right side figures indicate marks.

1 Explain the relation of Indian Logic with Epistemology. 14

**OR**

1 Explain the nature of Inference.

2 Explain the definition of Prama and its types. 14

**OR**

2 Explain the components of Inference.

3 Describe the types of Inference according to Navya Nyaya. 14

**OR**

3 Clarify with details the nature of five fold Inference.

4 What is Hetvabhasa ? Explain the "Badhit Hetvabhasa". 14

**OR**

4 Process of inference according to Nyaya.

5 Write short answers : (any two) 14

- (1) Characteristic of Valid Hetu.
- (2) Explain the background of Indian Logic.
- (3) Ashrayasiddha Hetvabhasa.
- (4) Svarupasiddha Hetvabhasa.